

ઉમેદવાર મિત્રો,

સ્પીપાની વેબસાઇટ પર તા.૨૦-૧૨-૨૦૧૭ ના રોજ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૧૮ ના તાલીમવર્ગ માટેની પ્રવેશ પરીક્ષાના પરિણામ અંગેનું જાહેરનામું અને મેરીટયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે અન્વયે તા.૨૬-૧૨-૨૦૧૭ (મંગળવાર) અને તા.૨૭-૧૨-૨૦૧૭ (બુધવાર)ના રોજ નીચે દર્શાવેલ પત્રકની વિગતે ઉમેદવારોને તેમના મેરીટ નંબર, કેટેગરી અને જે તે સંબંધિત સેન્ટર પર જગ્યાની ઉપલબ્ધતાને ધ્યાને લઈ, રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામતનીતિ મુજબ પ્રવેશ આપવા સારુ રજીસ્ટ્રેશન કેમ્પ, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, અને ડીપોઝીટ કલેક્શન શાખવામાં આવેલ.

તારીખ	હાજર થવાનો સમય	વિગત
૨૬-૧૨-૧૭	સવારે ૯.૦૦ કલાકથી	તમામ કેટેગરીની તમામ મહિલા ઉમેદવારો, તમામ વિકલાંગ ઉમેદવારો, અને ગુજરાત કોમર્સ કોલેજના ૦૩ અનામત ઉમેદવારો
	બપોરે ૦૧.૩૦ કલાક થી	મેરિટ નં. ૧ થી ૭૦ સુધીમાં સમાવિષ્ટ થતા તમામ કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારો
૨૭-૧૨-૧૭	સવારે ૯.૦૦ કલાક થી	મેરિટ નં. ૭૧ થી ૨૭૦ સુધીમાં સમાવિષ્ટ થતા તમામ કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારો
		મેરિટ નં. ૭૧ થી ૩૨૫ સુધીમાં સમાવિષ્ટ થતા એસસી કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારો
		મેરિટ નં. ૭૧ થી ૮૦૦ સુધીમાં સમાવિષ્ટ થતા એસટી કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારો
		મેરિટ નં. ૭૧ થી ૫૦૦ સુધીમાં સમાવિષ્ટ થતા એસઈબીસી કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારો

જે ઉમેદવારોએ ઉક્ત તારીખોએ રજીસ્ટ્રેશન કેમ્પમાં હાજર રહી પ્રવેશ મેળવેલ છે / મેળવેલ નથી, તેવા ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જો કોઈ ફરિયાદ હોય તો તેમણે તા.૩૧-૧૨-૨૦૧૭ સુધીમાં (દિન-૩માં) Email ID: spipa.pretrg18@gmail.com પર અચૂક મોકલી આપવાની રહેશે.

વધુમાં, ઉક્ત તારીખોએ રજીસ્ટ્રેશન કેમ્પમાં ગેરહાજર રહેલ ઉમેદવારોને વધુ એક તક આપતાં જણાવવામાં આવે છે કે, તેઓએ પણ Email ID: spipa.pretrg18@gmail.com પર પોતાની રજુઆત તા.૩૧-૧૨-૨૦૧૭ સુધીમાં(દિન-૩માં) મોકલવાની રહેશે. રજુઆતમાં નિયત તારીખે રજીસ્ટ્રેશન કેમ્પમાં હાજર ન રહેવા માટેનું કારણ, તથા તાલીમકેન્દ્રની પસંદગી જણાવવાની રહેશે.

ઉક્ત બાબતે રજુઆત મોકલતી વખતે ઉમેદવારે પોતાનું નામ, મેરિટ નંબર તથા પોતાનો Stage-2નો બેઠક નંબર અવશ્યપણે દર્શાવવાનો રહેશે. ઉપર પત્રકમાં દર્શાવ્યા મુજબના રજીસ્ટ્રેશન કેમ્પ માટે બોલાવેલ ઉમેદવારોની જ રજુઆતો ધ્યાને લેવામાં આવશે. તા.૩૧-૧૨-૨૦૧૭ બાદ મળેલ રજુઆતો ધ્યાને લેવામાં આવશે નહીં.

તા. ૩૧/૧૨/૨૦૧૭ સુધીમાં આવેલ તમામ રજુઆતો ધ્યાને લઈ, મેરીટ અને કેટેગરીવાઇઝ તાલીમવર્ગમાં ઉપલબ્ધ સીટ પર પ્રવેશ આપવા માટેનો સક્ષમ સત્તાધિકારી કક્ષાએ નિર્ણય લીધા બાદ, ખાલી રહેતી જગ્યાઓ પર ઉક્ત પત્રકમાં દર્શાવેલ ઉમેદવારો સિવાયના બાકી રહેતા ઉમેદવારોને પણ સંબંધિત કેટેગરીમાં ઉપલબ્ધતાના ધોરણે મેરીટ પ્રમાણે તક આપવામાં આવશે. જેની જાણ સંસ્થાની વેબસાઇટ પર કરવામાં આવશે.

-૬૬-

સંયુક્ત નિયામક (સ્ટડી)

સ્પીપા, અમદાવાદ